

KANUNGO FINANCIERS LIMITED

CIN:- L65100GJ1982PLC086450

Date: 02.09.2023

To
The Department of Corporate Affairs,
Bombay Stock Exchange Limited,
P J Towers, Dalal Street
Mumbai

CC: CALCUTTA STOCK EXCHANGELTD
7, Lyons Range, Murgighata
Dalhousie, Kolkata, West Bengal
700001

**SUB: NEWSPAPER ADVERTISEMENT FOR ANNUAL GENERAL MEETING AND
BOOK CLOSURE**

Ref.: BSE Script code:-540515

Dear Sir,

With respect to captioned subject, the company hereby informed you that the company has published in the Newspaper NOTICE OF ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE as per regulation 47 of SEBI (LODR), 2015. And the copies of the Newspaper Advertisement are attached herewith.

Kindly acknowledge the same & take on your records.

Thanking You.

Yours Faithfully

FOR KANUNGO FINANCIERS LIMITED

CHIRAG K SHAH
MANAGING DIRECTOR
DIN: 08111288

UPI-based payments cross 10 bn monthly transactions for 1st time

New Delhi, Sep 1 (IANS) The Unified Payments Interface (UPI)-based payments crossed 10 billion monthly transactions in August for the first time, according to the National Payments Corporation of India (NPCI). A

Monthly transaction count on UPI crossed 10.24 billion with a net transaction value of Rs 15.18 trillion, the NPCI confirmed late on Thursday.

Transactions on UPI have grown by over 50 per cent (year-on-year) and August saw 6.58 billion monthly transactions.

In July, the digital payments network had registered 9.96 billion transactions. UPI crossed 1 billion monthly transactions for the first time in October 2019. The UPI transactions rose manifolds between 2018 and 2022 in terms of value as well as volume, by 1,320 per cent and 1,876 per cent, respectively. In 2018, UPI transactions in terms of

volume stood at 374.63 crore, which went up by 1,876 per cent to 7,403.97 crore in 2022.

In terms of value, the UPI transactions were Rs 5.86 lakh crore in 2018, which went up by 1,320 per cent to Rs 83.2 lakh crore in 2022. RBI had in February this year allowed access to foreign nationals and NRIs visiting India by enabling them to make payments using UPI while they are in India.

This facility has been extended to travellers from G20 countries at select international airports (Bengaluru, Mumbai and New Delhi) for their merchant payments. The National Payments Corporation of India (NPCI) has said that the facility is allowed for 10 countries namely Singapore, Australia, Canada, Hong Kong, Oman, Qatar, the US, Saudi Arabia, the UAE and the UK. The UPI acceptance in foreign countries started in 2022.—IANS

Moody's raises India's GDP forecast to 6.7% for 2023

New Delhi, Sep 1 (IANS) Global rating agency Moody's has raised India's growth forecast to 6.7 per cent from 5.5 per cent for 2023.

At the same time though, it has lowered the GDP forecast for 2024 from 6.5 per cent to 6.1 per cent.

"Since the second quarter out performance creates a high base in 2023, we have lowered our 2024 growth forecast from 6.5 percent to 6.1 per cent. Given the robust underlying economic momentum, we also recognise further upside risk to India's economic growth performance," it said on Friday.

Moody's 6.7 per cent growth forecast for 2023 is slightly higher than RBI's projection of 6.5 per cent for 2023-24. India has recorded a growth of 7.8 per cent in the first quarter of the current fiscal, which was lower than RBI's projection of 8 per cent for the April-June period of 2023-24.

BGMI developer Krafton set to launch more games, further invest in India

New Delhi, Sep 1 (IANS) South Korean video game developer Krafton, the publisher behind popular Battlegrounds Mobile India (BGMI) game, is all set to launch more games in the coming year in India, while looking for the right strategic synergy to further invest in the country.

Sean Hyunil Sohn, CEO of Krafton India, said that BGMI will also have more announcements coming up for India before the Diwali festival.

We have a few games in our publishing pipeline. I think there could be one or two games we could even launch within this year, Sohn added during a media interaction here.

The company's focus has been on developing mobile gaming titles tailored to the Indian market.

Since March 2021, the company has invested \$140 million across 11 startups in-

cluding NODWIN Gaming, Loco, Pratilipi, Kuku FM, One Impression and more.

The company recently announced their commitment to invest an additional \$150 million over the next 2-3 years.

BGMI is not just a game, it is also a cultural and social experience. Krafton is not looking at building views; rather, we are focused on building a community basis fan-first research, according to Sohn. The company is also hosting a friendly India-Korea invitational match wherein BGMI will be played by 8 winning teams from BGIS and 8 Esports teams from South Korea.

Krafton will also release a documentary chronicling the story and development of the Indian Faction in Road To Valor: Empires. The move came two years after the Indian government banned Krafton's marquee offering PUBG in the country over

national security concerns.

BGMI was the Indian version of PUBG Mobile, exclusively for players in the country developed and published by Krafton. BGMI was the Indian version of PUBG Mobile, exclusively for players in the country developed and published by Krafton.

The Indian government later ordered Google and Apple to block the BGMI gaming app from their respective online stores under Section 69A of the Information Technology Act, 2000.

On May 30 this year, the South Korean video game developer said the video game BGMI is now available for play for all users in India on both Android and iOS.

The government allowed the return of the game on a three-month trial approval, after the company complied with issues of server locations and data security in the country.

Business Brief III

Investor sues Amazon for giving hefty launch contracts to Bezos' Blue Origin

San Francisco, Sep 1 (IANS) An institutional investor has sued e-commerce giant Amazon and its board, including founder Jeff Bezos, alleging there was no due diligence in the company's Project Kuiper hefty launch contracts to Blue Origin which is Bezos aerospace company. The suit, filed by Amazon shareholders the Cleveland Bakers and Teamsters Pension Fund, alleged that the company's board spent less than 40 minutes approving the launch agreements for Amazon Project Kuiper mega-constellation, while not even considering leading launch company (and Blue Origin rival) SpaceX, reports TechCrunch. Amazon directors likely devoted barely an hour before blindly signing off on funneling a money to Bezos unproven, struggling rocket company, the lawsuit read.

Y Combinator severs ties with Indian startup Medobed over 'irregularities'

San Francisco, Sep 1 (IANS) Leading US-based investment firm Y Combinator has reportedly taken stern action on Indian instant medicine delivery startup Medobed after discovering "irregularities" at the platform. According to TechCrunch, citing sources, Y Combinator has severed its ties with the Indian firm and a partner at the venture firm has also suggested to many prospective investors to not engage with Medobed. The venture firm had discovered irregularities at the startup that broke the firm ethics policy, the report mentioned. If you have anything outstanding with this company, our recommendation is to disengage completely with the company, according to the partner at the VC firm. Founded by Piyush Sharma, Medobed was initially selected in Y Combinator's S23 batch. Y Combinator and founders of Medobed were yet to comment. According to Medobed profile on LinkedIn, it is currently operational 24/7 in Bhopal and Indore with 10-min medicine delivery.

GDP growth will likely moderate in the quarters ahead

New Delhi, Sep 1 (IANS) Going ahead, GDP growth will likely moderate in the quarters ahead, Emkay Global Financial Services said in a report. Falling income growth in the urban sector, shrinking corporate profitability, fading momentum in (front-loaded) government capex, demand-curbing monetary policies and diminishing global growth prospects may weigh on output, the report said. Even as domestic activity is maintaining resilience, economic activity recovery is not yet broad-based. While rural income has remained tepid, urban employment growth has been steadily growing at a low rate and urban incomes will also likely ease ahead. This, in conjunction with the lagged effect of tighter monetary policy, will further curb domestic demand, the report said. On the other hand, capex indicators are healthy with further improving capacity utilisation and signs of rising new project announcements. The domestic economy will also face challenges going forward, with higher global uncertainty, tightening global financial conditions, lower corporate profitability ahead and still-elevated inflation.

Latest petrol price hike adds to miseries of people in Pakistan

Islamabad, Sep 1 (IANS) The Pakistan government has announced fresh increase in fuel prices, a decision being received as another blow for the masses, who are already grappling with inflation.

The substantial increase in fuel prices has also pushed per litre price of petrol and diesel to an all-time high. As per the latest increase announced for the first 15 days of September 2023, prices of

petrol have been increased by Rs14.91 per litre, pushing it to an all-time high of Rs 305 per litre. The per litre of High-Speed Diesel (HSD) has also increased by Rs 18.44, rising it up to an all-time high of Rs 311.84. This is the first time in Pakistan's history that prices of fuel have crossed the Rs 300 barrier. This comes at a time when the country is going through the worst form of inflation and economic crisis with every Pakistani feeling the extreme heat of its effects on their lives. The caretaker government attributed these adjustments to the escalating trajectory of global petroleum prices and its corresponding fluctuations in exchange rates. Pertinent to mention here that parallel to the towering and consistently increasing inflation and price hikes, the rupee has also been on a free fall against the US dollar with per dollar value crossing Rs 305 in the interbank and over Rs 350 in the open market. The stock market also saw a free fall crash on Thursday as it saw its second-biggest overnight decline in the benchmark index, that plummeted by around 1,250 points (2.7 per cent). Experts say that the market fall is driven by con-

cerns about the country's faltering economy, rumours of an impending interest rate hike, and the persistent depreciation of the rupee. The interim Finance Ministry of Pakistan maintains that the global trends of petroleum prices in the international market and exchange rate variations, which have prompted the latest increase in fuel prices. "Owing to the increasing trends to petroleum prices in the international market and exchange rate variations, the government has decided to revise the existing consumer prices of petroleum products," said a notification issued by the Interim Finance Ministry. The latest increase is expected to further inflame the persistent anger among people, who are already protesting skyrocketing electricity bills, burning down thousands of bills in street protests and criticising the government for making life impossible to survive for a common man.

Dry weather over India driving up rally in sugar prices

New Delhi, Sep 1 (IANS) The SandP GSFC Agriculture Index is finishing August 2 per cent lower MOM, reaching two-year lows. Grains led the decline, with wheat and corn futures both markedly down, Rabo Bank said in a research. Sizable US grain acreage following the largest annual increase in seven years, a record Brazilian corn harvest, and the continuation of significant wheat export flows from the Black Sea combined to drive prices lower. However, weather risks remain high for sugar, cocoa, robusta coffee, and Australian wheat, as El Niño effects become more apparent. India in particular has been getting quite dry, providing quite a lot of support for sugar, the report said. As El Niño strengthens toward the turn of the year, speculators on sugar, cocoa, and robusta coffee might stick around for a while. When it comes to sugar, the impact can be more immediate. El Niño could make Thailand, India, and Australia drier than normal. These are the

three largest exporters after Brazil. Fears of El Niño effects clearly underpinned the 40 per cent rally seen so far this year, the report said. India and Thailand are already dry, and output estimates have been revised lower. The biggest worry is whether reservoirs in India's key sugar-producing region of Maharashtra are low and unable to support growth for the 2024/25 season. Like sugar, coffee markets may also be strongly impacted given that Vietnam is the largest robusta producer in the world and Indonesia is number three. When it comes to cocoa, there is a slight correlation between dryness across West Africa (an area responsible for 70 per cent of global cocoa exports) and El Niño. Certainly, this was the case in the 2015/16 season, when a strong El Niño event led to weak West African production.

PATEL INDUSTRIES
AN ISO 9001 : 2008 COMPANY

CMC-Sodium Carboxymethyl Cellulose For Textiles, Detergents, Paints, Pesticide, Ceramic, Oil well drilling, Welding Electrodes etc.
CMS-Carboxy Methyl Starch For Textiles, Briquettes,
Cellulose Powder For welding rods

Address : Plot No 5623/c, Phase II, GIDC Industrial Area, Vatva, Ahmedabad-382445. Gujarat India.
CONTACT +91 98799 97220,
E-MAIL : info@patelindustries.co.in

Manufacturer & Exporter of Speciality Chemicals

CHANGE OF NAME

I have changed my old name from
PINJARA MANSURI
AYASHABIBI to MANSURI AYASHABIBI
Add. 103, Ronak Park, B/h Vejalpur Police Station 132 Ft Ring Road, Ahmedabad 2714

CHANGE OF NAME

I have changed my old name from
MOMIN VAHIDABEN ZULFIKARALI to KHANUSIYA VAHIDABEN ZULFIKARALI
Add. At Post : Virpur, Ta. Himatnagar, Dist. Sabarkantha K020

CHANGE OF NAME

I have changed my old name from
MOMIN ZULFIKARALI AYUBBHAI to KHANUSIYA ZULFIKARALI AYUBBHAI
Add. At Post : Virpur, Ta. Himatnagar, Dist. Sabarkantha K020A

CHANGE OF NAME

I have changed my old name from
PRAJAPATI VISHNUPRASAD KHODIDAS to PRAJAPATI VISHNUKUMAR KHODIDAS
Add. C-48, Shubhdarshan Tower, Jodhpur Satellite Ahmedabad-380015 A202

CHANGE OF NAME

I have changed my old name from
CHAVDA KANAKSINH to CHAVDA KANUSINH PRATAPSINH
Add. A-102, Radhika Residency, Mahudi Road, Pethapur Gandhinagar-382610 P201

CHANGE OF NAME

I have changed my old name from
PARESHKUMAR LALJIBHAI DESAI to PARESHBHAI LALJIBHAI DESAI
Add. At % Po. Bhadresar Tal. Idar Dist. Sabarkantha-383110 S237

GUJARAT MARITIME BOARD
Tender Notice No.17 of 2023-24

On Behalf of the Chairman, Gujarat Maritime Board, Executive Engineer (Mech.) Bedi port, Jamnagar invites on-line tenders for below mentioned works.

Name of the works	Estimated amount (Rs.)
1. Procurement of New Multi-Purpose Fire Tender for Navlakhi Port (Second attempt)	Rs. 1,35,90,000.00
2. S.R. to Tug GMB-II of Porbandar Port to carry out Docking & special Hull Survey. (Second attempt)	Rs. 1,10,54,477.40
3. S.R. to Tug GMB-III of Porbandar Port to carry out Docking & special Hull Survey. (Second attempt)	Rs. 1,00,52,578.00
4. S.R. to Tug Gopnath of Okha Port to carry out Docking & special Hull Survey (Second attempt)	Rs. 78,80,632.00

Schedule of e-tendering

Last date of Uploading till **21/09/2023 up to 18:10 hrs.**

All other details as per tender document. Bidder can view, download & submit their bid through www.nprocure.com, only. Tender documents will also be available on GMB web site: www.gmbports.org

Executive Engineer (Mech.)
G.M.B Jamnagar

મહિત્વપૂર્ણ જાહેરાત / ૨૦૦૨૩

SHIVANSH FINSERVE LIMITED

CIN: L65100GJ1984PLC082579
Registered Office: 22 First Floor, Harsidhi Complex, Opp. Kalupur Commercial Bank, Income Tax, Ashram Road, Ahmedabad-380014 Gujarat
Email id: shivanshfinserve@gmail.com

NOTICE OF ANNUAL GENERAL MEETING AND BOOK CLOSURE

Notice is hereby given that the annual general meeting of SHIVANSH FINSERVE LIMITED will be held on Tuesday, 26th Day of September, 2023 at 03:00 p.m. at registered office of the company to transact the ordinary and special business, as set out in the Notice of the said meeting.

Notice of Annual report and AGM: In compliance with the applicable provision of the Companies Act, 2013 and the rules made thereunder, the Notice together with Annual Report for the Financial Year 2022-23 has been sent to Members. The Notice of the AGM together with Annual Report is also available on the company's website: www.shivanshfinserve.com. Members who have not received the Notice and Annual Report, may refer or download the same from the website of the company or may request for a soft copy of the same by writing to the company by Email ID: shivanshfinserve@gmail.com or at the registered office of the company.

Notice of BOOK CLOSURE PERIOD: Notice is hereby given that pursuant to section 91 of the Companies Act, 2013 read with the Companies (Management and Administration) Rules, 2014 the register of members and share transfer books of the company will remain closed from 20.09.2023 to 26.09.2023 (both days inclusive) for the purpose of ensuring annual general meeting of the company to be held on 26th September, 2023.

FOR, SHIVANSH FINSERVE LIMITED
Sd/-
WHOLETIME DIRECTOR
JIGNESH SHAH
DIN: 02112343

PURPLE ENTERTAINMENT LIMITED

CIN: L65100GJ1974PLC084389
Registered Office: 30-B, THIRD FLOOR, AJANTA COMPLEX, INCOME TAX, ASHRAM ROAD, AHMEDABAD 380009 Gujarat
Email id: purpleentertainment7@gmail.com <https://purple-entertainment.co.in/>

NOTICE OF ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE

Notice is hereby given that the annual general meeting of PURPLE ENTERTAINMENT LIMITED will be held on 27th September, 2023, Wednesday, AT 12.00 P.M. at registered office of the company to transact the ordinary and special business, as set out in the Notice of the said meeting.

Notice of Annual report and AGM: In compliance with the applicable provision of the Companies Act, 2013 and the rules made thereunder, the Notice together with Annual Report for the Financial Year 2022-23 has been sent to Members. The Notice of the AGM together with Annual Report is also available on the company's website: <https://purple-entertainment.co.in/>. Members who have not received the Notice and Annual Report, may refer or download the same from the website of the company or may request for a soft copy of the same by writing to the company by Email on purpleentertainment7@gmail.com or at the registered office of the company.

Notice of BOOK CLOSURE PERIOD: Notice is hereby given that pursuant to section 91 of the Companies Act, 2013 read with the Companies (Management and Administration) Rules, 2014 the register of members and share transfer books of the company will remain closed from 21.09.2023 to 27.09.2023 (both days inclusive) for the purpose of ensuring annual general meeting of the company to be held on 27th September, 2023.

FOR, PURPLE ENTERTAINMENT LIMITED
Sd/-
MANAGING DIRECTOR
CHIRAG KIRTIKUMAR SHAH
DIN: 08111288

KANUNGO FINANCIERS LIMITED

CIN: L65100GJ1982PLC086450
REGISTERED OFFICE: B/7, 'B' Wing, 5th Floor, Ajanta Commercial Center Income Tax, Ashram Road, Ahmedabad-380009 Gujarat.
Email id: kanungofinanciers@gmail.com

NOTICE OF ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE

Notice is hereby given that the annual general meeting of KANUNGO FINANCIERS LIMITED will be held on Tuesday, 26th September, 2023 at 12:00 p.m. at registered office of the company to transact the ordinary and special business, as set out in the Notice of the said meeting.

Notice of Annual report and AGM: In compliance with the applicable provision of the Companies Act, 2013 and the rules made thereunder, the Notice together with Annual Report for the Financial Year 2022-23 has been sent to Members. The Notice of the AGM together with Annual Report is also available on the company's website: www.kanungofinanciers.com. Members who have not received the Notice and Annual Report, may refer or download the same from the website of the company or may request for a soft copy of the same by writing to the company by Email ID: kanungofinanciers@gmail.com or at the registered office of the company.

Notice of BOOK CLOSURE PERIOD: Notice is hereby given that pursuant to section 91 of the Companies Act, 2013 read with the Companies (Management and Administration) Rules, 2014 the register of members and share transfer books of the company will remain closed from 20.09.2023 to 26.09.2023 (both days inclusive) for the purpose of ensuring annual general meeting of the company to be held on 26th September, 2023.

FOR, KANUNGO FINANCIERS LIMITED
Sd/-
MANAGING DIRECTOR
CHIRAG KIRTIKUMAR SHAH
DIN: 08111288

MANAPPURAM HOME FINANCE LIMITED
FORMERLY MANAPPURAM HOME FINANCE PVT LTD
CIN : U65923K12010PIC039179

Regd Office : IV/470A (OLD) W/638A (NEW) Manappuram House Valapad Thiruvuru, Kerala 680567
Corp Office : Manappuram Home Finance Limited, Third Floor, Unit No. 301 to 315, A Wing, 'Kanakkia Wall Street', Andheri-Kurla Road, Andheri East, Mumbai 400093, Maharashtra. Phone No.: 022-66211000. Website : www.manappuramhomefin.com

DEMAND NOTICE

A notice is hereby given that the following borrower/s have defaulted in the repayment of principal and interest of the loan facility obtained by them from the Company and the loans have been classified as Non-Performing Assets (NPA). The notice dated were issued to them under Section 13 (2) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act-2002 on their last known addresses as provided to the company by them, that in addition thereto for the purposes of information of the said borrower/s enumerated below, the said borrower/s are being informed by way of this public notice.

Sr. No.	Name of the Borrower/ Co-Borrower/ LAN/Branch	Description of Secured Asset in respect of which interest has been created	NPA Date	Date of Notice sent & Outstanding Amount
1	Hiren Ramanbhai Patel Ramilaben Ramanbhai Patel WAHME0002383/ Ahmedabad	Flat No. 406, Nirgun Homes, Near Samor Residency, NR Om Shanti Nagar, Opp Dev Manek, Mouje - Vatva, Taluka - Vatva, Dist - Ahmedabad, Gujarat, Pin: 380050	11-07-2023	16-08-2023 Rs. 5,84,038/-

The above borrower/s are advised to make the payments of outstanding within period of 60 days from the date of issuance of notice U/s. 13 (2), failing which further steps will be taken after expiry of 60 days from the date of issuance of notice U/s. 13 (2) dated mentioned above as per the provisions of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002

Sd/-
Authorised Officer
Manappuram Home Finance Ltd

Date: 2nd September 2023
Place: GUJARAT

GALAXY BEARINGS LIMITED

CIN: L29120GJ1990PLC014385
Regd. Office : A-53/54 Pariseema Complex, C. G. Road, Ellisbridge, Ahmedabad - 380006.
Tel.: 079-29606020. Email: investor.gbl@gmail.com • Website: www.galaxybearings.com

NOTICE TO THE SHAREHOLDERS FOR 33RD ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the 33rd Annual General Meeting (AGM) of the Company will be held on Tuesday, September 26, 2023 at 03.30 p.m. (IST) through Video Conference ("VC")/Other Audio Visual Means ("OAVM") in compliance with the all applicable provisions of the Companies Act, 2013 and rules made there under read with the General Circular No. 10/2022 dated December 28, 2022 issued by the Ministry of Corporate Affairs ("MCA") read together with other Circulars issued by MCA in this regard (collectively referred to as "MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 issued by the Securities and Exchange Board of India ("SEBI") read together with other Circulars issued by SEBI in this regard (collectively referred to as "SEBI Circulars"), companies are permitted to convene the AGM through VC or OAVM without physical presence of the Members at a common venue till September 30, 2023. Accordingly, the AGM of the Company is being held through VC/OAVM. Members will be provided with a facility to attend the AGM through electronic platform provided by InstaMeet.

In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Annual Report 2022-23 is being sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Members may note that the Notice of AGM and Annual Report 2022-23 will also be available on the Company's website www.galaxybearings.com, website of the Stock Exchange i.e. BSE Limited i.e. www.bseindia.com and website of Link Intime India private Limited at instavote.linkintime.co.in. Members can attend and participate in the AGM through the VC/OAVM facility only.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of 33rd AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). Detailed procedure for remote e-voting/e-voting during the AGM by members holding shares in physical mode and members, who have not registered their mail id with the Company will be provided in the Notice of AGM.

In case Member(s) have not registered their e-mail addresses with the Company/Depositories/Registrar and Share Transfer Agent (RTA) so far, are requested to register/update their e-mail addresses in the following manner:

- Members holding shares in Demat mode can get their Email ID registered by contacting their respective Depository Participant.
- Members holding shares in Physical form can send request to the Company at investor.gbl@gmail.com or to RTA i.e. Link Intime India Private Limited at ahmedabad@linkintime.co.in by providing necessary details like Folio No., Name of Shareholder, scanned copy of the Share Certificate (front and back), PAN and AADHAR (self-attested scanned copy), Contact No. for registering email address.

The above information is being issued for the information and benefit of all the Members of the Company and is in Compliance with the MCA Circular/s and SEBI Circular.

By Order of the Board For Galaxy Bearings Limited

Bharatkumar K. Ghodasara
Whole-time Director
(DIN: 00032054)

Place: Ahmedabad
Date: September 02, 2023

